

## વિકસતિ જાતિ કલ્યાણ ખાતું ગુજરાત રાજ્ય, ગાધીનગર

સા.શૈ.પ.વ.ના લેખકો, સાહિત્યકારો અને પી. એચ. ડી. ધારકોને તેમના સાહિત્ય પ્રકાશન માટે નાણાકીય સહાય મેળવવા માટેનું અરજીપત્રક.



પાસ પોર્ટ સાઇઝનો  
ફોટો તથા તેના  
ઉપર સહી

- ૧ સાહિત્યકાર/સંશોધકનું નામ :  
(અટક પહેલાં લખવી)
- ૨ પુરેપૂરું સરનામું (ટેલિફોન નંબર સહિત) :
- ૩ જાતિ/પેટા જાતિની વિગતો :  
(જાતિ પ્રમાણપત્રની નકલ જોડવી)
- ૪ સાહિત્ય સર્જન કેટલા સમયથી કરો છો ? :
- ૫ અત્યાર સુધીમાં પ્રસિદ્ધ થયેલ :  
સાહિત્ય અંગેની સંક્ષિપ્ત વિગતો (સાથે જોડવી)
- ૬ પ્રકાશિત કરવાના સાહિત્યની :  
વિગતો
- ૭ પ્રકાશકનું નામ અને સરનામું :
- ૮ પ્રકાશન પાછળ થનાર અંદાજીત :  
ખર્ચની વિગત
- ૯ પ્રકાશન કેટલા સમયમાં પૂર્ણ થશે :
- ૧૦ પ્રકાશન ક્યારે પ્રસિદ્ધ થશે ? :

સ્થળ :

અરજદારની સહી

તારીખ :

સા.શૈ.પ.વ.ના લેખકો, સાહિત્યકારો અને પી. એચ. ડી. ધારકોને તેમના સાહિત્યના પ્રકાશન માટે નાણાકીય સહાય આપવા અંગેના નિયમો

સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તારીખ: ૧૮/૧/૨૦૦૩ના ઠરાવ ક્રમાંક: સશપ/૧૦૨૦૦૧/ન.બા.-૩૦/અ-૧થી સા.શૈ.પ.વ.ના સાહિત્યકારો, સર્જકો, સંશોધકો અને પી.એચ.ડી. ધારકોને તેમના લખાણો પ્રસિદ્ધ કરવા માટે રૂ. ૧૦,૦૦૦/- (અકે રૂપિયા દશ હજાર પુરા) સુધીની સહાય આપવાની યોજના અમલમાં મુકવામાં આવેલ છે. વખતો વખત થયેલ સુધારા અનુસાર આ યોજના અંગેની સામાન્ય શરતો નીચે મુજબ છે.

૧ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગના સાહિત્યકારોને પછાતવર્ગોની વિવિધ સમસ્યાઓ ઉપરાંત અન્ય તમામ પ્રકારના બાળ સાહિત્ય, હાસ્ય, સામાજિક જેવા મૌલિક લખાણો અને સાહિત્યના પ્રકાશન માટે સહાય મળવાપાત્ર રહેશે.

૨ આ સહાય કેવળ મૌલિક લખાણો માટે જ મળી શકશે. અન્ય કોઇપણ અનુવાદ માટે સહાય મળી શકશે નહીં.

૩ શરતો:-

(ક) સહાય માટે પાત્ર ઠરેલી હસ્તપ્રત માટે વધુમાં વધુ રૂ. ૧૦,૦૦૦ (દશ હજાર)ની મર્યાદામાં હસ્તપ્રતની ૫૦૦ નકલોના મુદ્દણ અગે કરેલા ખરેખર ખર્ચના ૭૫ ટકા સહાય આપવામાં આવશે. પરંતુ કોઇપણ કિસ્સામાં સહાયની રકમ રૂ.૧૦,૦૦૦/- (અકે રૂપિયા દશ હજાર પુરા)થી વધશે નહીં મંજૂર કરાયેલ સહાયની કૃતિ પ્રકાશિત કરી તેના મુદ્દણ અંગેના વાઉચર નિયામક, વિકસતી જાતિ કલ્યાણને રજૂ કર્યેથી સહાયની રકમ ચુકવવાપાત્ર થશે.

(ખ) પ્રગટ કરેલી નકલોની સખ્યા ૫૦૦ કરતાં ઓછી હોવી જોઇશે નહીં.

(ગ) પ્રગટ કૃતિની ૧૫ નકલો વિનામૂલ્યે નિયામક, વિકસતી જાતિ કલ્યાણ, ગાંધીનગરને આપવાની રહેશે.

(ઘ) સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકારની નાણાકીય સહાયથી પ્રકાશિત કર્યું. એવી ઋણ સ્વીકારની પંક્તિ અંદરના મુખ્યપૃષ્ઠની પાછળ સ્પષ્ટ રીતે છપાવવાની રહેશે.

(ચ) પ્રગટ થતી કૃતિમાં કોઇ જાહેરાત કે કોઇ પ્રકારનો વેપાર વિષયક સંદેશો લઇ શકાશે નહીં.

(છ) નિયામક, વિકસતી જાતિ કલ્યાણની પૂર્વ મંજૂરી સિવાય આ યોજના હેઠળ સહાય મંજૂર કરવામાં આવી હોય તેવી હસ્તપ્રતમાં કોઇ સુધારો કરી શકાશે નહીં.

(જ) હસ્તપ્રત મંજૂરીના હુકમની તારીખથી એક વર્ષમાં પ્રગટ કરવાની રહેશે. સમયમર્યાદામાં પ્રગટ નહીં કરનારની સહાય આપોઆપ રદ થયેલી ગણાશે. નિયામક વિકસતી જાતિ કલ્યાણને પોતાને એમ કરવું જરૂરી જણાય તો સહાય મંજૂર કરતા હુકમ હેઠળ ઉપર જણાવેલી શરતો ઉપરાંત બીજી શરતોનું પાલન કરવાનું આવશ્યક બનાવી શકાશે.

(ઝ) હસ્તપ્રતની જોડણી સરકાર માન્ય ગુજરાત વિધાપીઠની સાથે જોડણીકોશ પ્રમાણે રાખવાની રહેશે.

(ટ) મળેલ સહાયની રકમ અન્ય કોઇ ખાનગી પ્રકાશન કે સંસ્થાને તબદીલ કરી શકાશે નહીં તથા તે માટેની આર્થિક સહાય અન્યત્રેથી મેળવી શકાશે નહીં.

## :: એકરાર નામું ::

આથી હું ..... રહે

.....ઉંમર

વર્ષ..... લેખિત બાંહેધરી આપુ છું કે સરકારશ્રીના તા.૧૮/૧/૨૦૦૩ના ઠરાવ ક્રમાંક: સશપ/ ૧૦૨૦૦૧/ ન.બા.૩૦/ અ-૧ થી અમલમાં મુકવામાં આવેલ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિના લેખકો, સાહિત્યકારો અને પી.એચ.ડી. ધારકોને તેમના સાહિત્યના પ્રકાશન માટે રૂ.૧૦,૦૦૦/- સુધીની સહાય આપવાની યોજના અન્વયે નિયત કરવામાં આવેલ તમામ શરતો મેં કાળજી પૂર્વક વાંચેલ છે અને તે મને કબૂલ મંજૂર છે તથા તમામ શરતો પરિપૂર્ણ કરવાની આથી ખાતરી આપું છું.

જે હેતુ માટે નાંણાકીય સહાય મંજૂર થઇ છે તે સિવાય અન્ય હેતુ માટે તેનો ઉપયોગ નહીં કરવા બાંહેધરી આપું છું જો અન્ય હેતુઓ માટે સહાયની રકમ વાપરીશ અથવા તે હેતુ માટે ઉપયોગ ન કરૂ તો નાણાકીય સહાયની રકમ સરકાર ઠરાવે તે વ્યાજ સહિત એક જ હપ્તામાં પરત ભરપાઇ કરવા આથી હું બાંહેધરી આપું છું.

સ્થળ :

અરજદારની સહી

તારીખ :